



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૧૧/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૦૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૧ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૯૧ લીટર દેશી દારૂ અને ૧૩ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૧૧ કેસ કરી ૫૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૨,૯૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૦૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગય:-

સમાચાર યાદી નં.૨૨૦૯/૧૮

માધવપુરા: કલ્પેશભાઈ લલીતભાઈ પટ્ટણી (ઉ.વ.૨૪) (રહે.અભીનવ એપાર્ટમેન્ટ, જૈન દેરાસર પાસે કૃષ્ણનગર નરોડા) તા.૧૦/૧૧/૧૮ રાતના ૧૦/૨૦ વાગ્યાના સુમારે દિલ્હી દરવાજા ફરકી દુકાન પાસે સોપાન કોમ્પલેક્ષ આગળથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટીવા ઉપર આવેલ એક પુરૂષ કલ્પેશભાઈના ગળામાંથી સોનાની ચેઇન સિલ્વર-ગોલ્ડ મિક્ષ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ કલ્પેશભાઈએ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૨૧૦/૧૮

મણીનગર: રાજેશભાઈ ઉદેસંગભાઈ મકવાણા (રહે.ગામ-પરીયજ તા-માતર,જી-ખેડા) એ તા.૦૨/૧૧/૧૮ રાતના ૧૦/૦૦ વાગે મણીનગર એલ.જી.હોસ્પિટલ જુના ગેટની બાજુમા પોતાની ઈસ્કો ગાડી નંબર જીજે.૦૭ બીઆર ૦૯૭૫ કિંમત રૂપિયા ૩,૩૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી ૪૫ મીનીટમાં થઈ હતી. આ અંગેની ફરીયાદ રાજેશભાઈ મકવાણાએ તા.૧૧/૧૧/૧૮ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.ગળચર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૧૧/૧૮

અમરાઇવાડી: કીરીટ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૮) (રહે.ચામુંડાનગર સ્વસ્તિક ચાર રસ્તા અમરાઇવાડી) એ અગમ્ય કારણસર તા.૧૧/૧૧/૧૮ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રમેશચંદ્ર સામતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.